



प्रोसेसिंग અને ફૂડ ઈજનેરી વિભાગ

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ,
આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા

“પોસ્ટ હારવેસ્ટની પ્રક્રિયાઓ અને મૂલ્ય વર્ધન”

પ્રોસેસિંગ અને ફૂડ ઈજનેરી વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા ખાતે તા. ૨૦/૦૯/૨૦૧૮ના રોજ “પોસ્ટ હારવેસ્ટની પ્રક્રિયાઓ અને મૂલ્ય વર્ધન” વિષય ઉપર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સૌ પ્રથમ અત્રેની કોલેજના ડો. આર. સ્વર્ણકાર (પ્રાધ્યાપક અને વડા, ફાર્મ મશીનરી અને પાવર ઈજનેરી વિભાગ), ઇજ. આલોક કુમાર (સીનીયર પ્રોગ્રામ ઓફિસર, સતગુરુ ફાઉન્ડેશન, દાહોદ), ડો. નવનીત કુમાર (સહ પ્રાધ્યાપક અને વિભાગીય વડા, પી.એફ.ઈ. વિભાગ) તથા કોલેજના અન્ય વિભાગીય વડાશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ ઇજ. કમલેશ જેઠવા, મદદનીશ પ્રાધ્યાપક, પી.એફ.ઈ. વિભાગ દ્વારા મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ડો. નવનીત કુમારે પ્રાસંગિક ઉદ્બોધનમાં આમંત્રિત તમામને આવકારી અને ખેતીમાં “પોસ્ટ હારવેસ્ટની પ્રક્રિયાઓ અને મૂલ્ય વર્ધન” પર માહિતી આપવામાં આવી, ત્યારબાદ ઇજ. આલોક કુમાર દ્વારા સતગુરુ ફાઉન્ડેશન વિષે માહિતી આપવામાં આવી અને ડો. આર. સ્વર્ણકાર દ્વારા વિષય અંતર્ગત કોલેજમાં કાર્યરત જુદા જુદા વિભાગોમાં થયેલ સંશોધનો અને ઉપલબ્ધ સાધનો વિષે ઊંડાણપૂર્વક માહિતી આપી અને તેનો ખેતીમાં ઉપયોગ કરી આવક બમણી કરવા માટેના જુદા જુદા ઉપાયો વિશે સમજણ આપવામાં આવી અને ડો. નીરજ સેઠ, મદદનીશ પ્રાધ્યાપક, પી.એફ.ઈ. વિભાગ દ્વારા ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આ તાલીમ કાર્યક્રમમાં ડો. નીરજ સેઠ દ્વારા કૃષિ પાકોમાં પોસ્ટ હારવેસ્ટની વિવિધ પ્રક્રિયા ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ ડો. નવનીત કુમાર દ્વારા કૃષિ પાકોમાં સુકવણી અને સંગ્રહ ઉપર માહિતી સભર વ્યાખ્યાન આપવામાં આવ્યું અને ઇજ. કમલેશ જેઠવા દ્વારા કૃષિ પાકોમાં મૂલ્ય વર્ધનથી આવક વધારવાના ઉપાયો પર વક્તવ્ય આપવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ઇજ. યાજ્ઞિક સી. યોગનાંદી અને શ્રી પી. એમ. મકવાણા દ્વારા ખેડૂતોને એક્સિબિશન હોલ અને વિભાગીય લેબોરેટરીમાં રાખેલ વિવિધ પ્રોસેસિંગ, ડ્રાઈંગ, સંગ્રહ અને

પોસ્ટ હારવેસ્ટના સાધનો વિષે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત લેબોરેટરીમાં ડૉ. નીરજ સેઠ અને એમ. ટેક. વિદ્યાર્થીઓ દ્વારા સોયાબીનમાંથી દૂધ અને પનીર બનાવવાનું પ્રેક્ટીકલ નિદર્શન કરવામાં આવ્યું.

આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. નવનીત કુમાર (સહ પ્રાધ્યાપક અને વિભાગીય વડા), ડૉ. નીરજ સેઠ (મદદનીશ પ્રાધ્યાપક), ઈજ. કમલેશ જેઠવા (મદદનીશ પ્રાધ્યાપક), ઈજ. યાજ્ઞિક સી. યોગનાંદી (સીનિયર રિસર્ચ આસિસ્ટન્ટ), શ્રી પી. એમ. મકવાણા (લેબ ટેકનીશીયન), અમર શર્મા, ચાંદની પોપલીયા અને શક્તિ ચાવડા (એમ. ટેક. વિદ્યાર્થીઓ) દ્વારા યોગદાન આપવામાં આવ્યું.





